

પ્રેસ નોટ

રાજ્ય સરકાર હસ્તકની વિજ વિતરણ કંપનીઓ માટેના ટેરીફ ઓર્ડર

- ધરવપરાશના તમામ વીજગ્રાહકોના વીજદરમાં ૧૦ પૈસા/યુનિટનો ઘટાડો
- અર્બન ડેવલપમેંટ એઓથોરીટીના ભૌગોલિક સત્તા વિસ્તાર હેઠળના ગામડાઓના ધરવપરાશ કરતા ગ્રાહકોને હવેથી ૨૫ પૈસા/યુનિટ જેટલો ઓછો વિજદર લાગુ પડશે.
- એલટીએમડી અને એચટી કેટેગરીના ગ્રાહકોના વિજદરમાં ટેરીફ રેશનલાઇઝેશન પછી એકંદરે અનુક્રમે ૧૦ પૈસા/યુનિટ અને ૧૪ પૈસા/યુનિટનો ઘટાડો
- રાત્રિના સમયે વીજ વપરાશ પરની શરતોને હળવી બનાવવામાં આવી.

રાજ્ય સરકાર હસ્તકની ચારેય વિજવિતરણ કંપનીઓએ પોતાના વર્ષ ૨૦૧૪-૧૫ના ટુ-અપ અને વર્ષ ૨૦૧૬-૧૭ માટે વિજવિતરણ દરો નક્કી કરવા માટેની દરખાસ્ત, જીઈઆરસીના બહુવર્ષીય વિજ દર નક્કી કરવાના વિનિયમો હેઠળ આયોગ સમક્ષ રજૂ કરેલ હતી.

આયોગ દ્વારા સદર દરખાસ્તોની ચકાસણી કર્યા બાદ આમ જનતા અને હિત ધરાવનારાઓ પાસેથી વાંધા અને સૂચનો મંગાવવાની વિસ્તૃત પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. આ અંગે આયોગ દ્વારા તા.૧૨-૦૨-૨૦૧૬ના રોજ ગાંધીનગર ખાતે રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવેલ. આ સુનાવણીમાં હિત ધરાવનારાઓએ, વ્યક્તિગત અને સંસ્થાકીય ધોરણે પોતાના વાંધા/સૂચનો આયોગ સમક્ષ રજૂ કરેલ.

આયોગ (સભ્યશ્રી કે.એમ.શ્રિંગારપૂરે અને સભ્યશ્રી પી.જે.ઠક્કર) દ્વારા તા.૩૧-૦૩-૨૦૧૬ના રોજ સદર દરખાસ્તો અંગે હુકમો કરવામાં આવેલ છે.

રાજ્ય સરકાર હસ્તકની ચારેય વિજવિતરણ કંપનીઓ (મધ્ય ગુજરાત વિજ કંપની લી. અને પશ્ચિમ ગુજરાત વિજ કંપની લી. સિવાય)ના લાઇન લોસ આયોગે મંજૂર કરેલા લાઇન લોસથી ઓછા રહેવા પામેલ., જે નીચેના કોઠામાં દર્શાવેલ છે.

વર્ષ ૨૦૧૪-૧૫ના લાઇન લોસ

	મંજૂર કરાયેલ લોસ	વાસ્તવમાં નોંધાયેલ લોસ
દક્ષિણ ગુજરાત વિજ કંપની	૧૧.૫૦%	૯.૧૧%
મધ્ય ગુજરાત વિજ કંપની	૧૨%	૧૨.૨૭%
પશ્ચિમ ગુજરાત વિજ કંપની	૨૪%	૨૪.૬૧%
ઉત્તર ગુજરાત વિજ કંપની	૧૨.૨૫%	૯.૨૦%

વર્ષ ૨૦૧૪-૧૫ માટે વિજ વિતરણ કંપનીઓએ અંદાજેલી રૂ.૨૩૪.૭૭ કરોડની ઘટ સામે આયોગે ચારેય વિજવિતરણ કંપનીઓની સંયુક્ત સિલક રૂ.૧૧૫.૭૬ કરોડ મંજૂર કરેલ છે. વર્ષ ૨૦૧૬-૧૭ ની મંજૂર થયેલ વાર્ષિક મહેસૂલી જરૂરીયાત ગણતરીમાં લીધા બાદ વર્ષ ૨૦૧૬-૧૭ ની સિલક રૂ.૬૫૬.૫૫ કરોડ આયોગ દ્વારા અંદાજવામાં આવેલ છે.

રાજ્ય સરકારની વિજ વિતરણ કંપનીઓએ વર્ષ ૨૦૧૬-૧૭ના કામચલાઉ વાર્ષિક મહેસૂલી જરૂરિયાતના આધારે વિજદરમાં કોઈ જ ફેરફાર ન કરવાની માંગણી કરેલ. આમ છતાં, આયોગે અંદાજેલ સિલકનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય લીધેલ છે અને ધરવપરાશ કરતા તમામ વિજ ગ્રાહકોના વિજદરમાં ૧૦ પૈસા/યુનિટનો ઘટાડો કરેલ છે.

અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના ભૌગોલિક સત્તા વિસ્તાર હેઠળના ગામડાઓ અત્યાર સુધી શહેરી વિસ્તારના વિજદર મુજબ વિજ બીલો ભરતા હતા. આયોગે આવા ગામડાઓના ધરવપરાશના ગ્રાહકોને ગ્રામ્ય વિસ્તારનો વિજદર કે જે શહેરી વિસ્તારના ધરવપરાશના વિજદર કરતા ૨૫ પૈસા ઓછો છે તે લાગુ કરવાનું નક્કી કરેલ છે.

વધુમાં રાત્રિ સમયના વિજવપરાશને પ્રોત્સાહન આપવા અંગે અને તેને સંલગ્ન લાભો મળી રહે તે માટે રાત્રિ વપરાશ અંગેની ૧/૩ વપરાશની શરતને નાબૂદ કરવામાં આવેલ છે. આથી, હવેથી રાત્રિ સમય દરમિયાન એટલે કે રાત્રે ૧૦.૦૦ થી બીજા દિવસના સવારના ૦૬.૦૦ વાગ્યા સુધી થયેલા સંપૂર્ણ વિજવપરાશ પર વિજ દરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. આ ફેરફારને કારણે ગ્રાહક કે વિતરણ પરવાનેદાર પર કોઈપણ પ્રકારનો બોજો ન આવે તેટલા માટે રાત્રિ સમયના વિજદરનો છૂટછાટનો દર ૮૫ પૈસા/યુનિટના સ્થાને ૪૦ પૈસા/યુનિટ કરવામાં આવેલ છે. તદ્દુપરાંત રાત્રિ સમયના

વિજવપરાશને પ્રોત્સાહન આપવા માટે તથા ગ્રાહક અને પરવાનેદાર બંનેને પૂરતી સ્પષ્ટતા રહે તે રીતે એનઆરજીપી-નાઇટ, એલટીએમડી નાઇટ અને એચટીપી-૪ ટેરીફ ક્રેટેગરીની વિવિધ શરતોને હળવી બનાવવામાં આવેલ છે.

ગ્રાહક ક્રેટેગરી વચ્ચેના પરસ્પરના આર્થિક સહાયના ધોરણને વાજબી કરવા અને પરવાનેદારના ફિક્સ્ડ ખર્ચાઓની ફિક્સ્ડ ચાર્જમાંથી યોગ્ય પ્રમાણમાં પૂર્તતા કરવા માટે એલટીએમડી અને એચટી ક્રેટેગરીના ગ્રાહકોનાં વિજદરમાં અનુક્રમે ૧૦ પૈસા/યુનિટ અને ૧૪ પૈસા/યુનિટનો ઘટાડો થાય તે રીતે વિજદરો સુધારવામાં આવેલ છે.

આ હુકમ તા ૦૧/૦૪/૨૦૧૬થી અમલી બનશે. સુધારેલ વિજદરો તા.૦૧/૦૪/૨૦૧૬ થી થતા વીજળી વપરાશ પર લાગુ પડશે.

-સહિ-
રૂપવંતસિંહ(આઇ.એ.એસ.)
સચિવ
ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ,
ગાંધીનગર